

ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીહયનલ ડેવલપમેન્ટ ઓથોરીટી

કે - ઉદ્યોગ ભવન, બ્લોક નં.૧૧-૧૨, ૩જો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર (૩૮૨૦૧૭)

ફોન: +૦૭૯-૨૩૨૪૦૧૫૦-૨-૪, ફેક્સ: ૦૭૯-૨૩૨૪૮૪૪૩

નમુનો - ધ (નિયમ-૧૦)

વિકાસ માટે પરવાનગી

(સબપ્લોટીંગ માટે)

શ્રી અરવિંદભાઈ હીરાલાલ પંડ્યા ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ - ૨૦૦૯ની કલમ ૧૫ થી ૧૭ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ (સને ૧૯૭૬ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં.૨૭) ની કલમ ૨૬ થી ૪૯ હેઠળ મોજે-ધોલેરા, તા-ધોલેરા, જીલ્લો-અમદાવાદ ના જુના સર્વે નં. ૪/૨૫૬૩ (નવો સર્વે નંબર-૪૯) જેનો સમાવેશ એપેક્ષ ઓથોરીટી (જી.આઈ.ડી.બી.) દ્વારા મંજૂર મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૨માં થાય છે જે દરખાસ્ત મુજબ મોજે ગામ-ધોલેરાનાં જુના સર્વે નં. ૪/૨૫૬૩ (નવો સર્વે નંબર-૪૯) ને મૂળખંડ નં. ૮૨૯/૨આપી તેની સામે અંતિમખંડ નં. ૮૨૯/૨ ફાળવેલ છે. મંજૂર થયેલ મુસદ્દારૂપ નગર રચના યોજના ની દરખાસ્તો મુજબ મૂળખંડ અને અંતિમખંડ નું ક્ષેત્રફળ અનુક્રમે ૪૦,૪૬૯ ચો.મી. અને ૨૦,૨૩૫ ચો.મી. હતું. નગર રચના અધિકારીશ્રી દ્વારા તૈયાર કરાયેલ કામચલાઉ પુનઃબંધારણની દરખાસ્તો મુજબ મોજે ગામ-ધોલેરાનાં જુના સર્વે નં. ૪/૨૫૬૩ (નવો સર્વે નંબર-૪૯) ને મૂળખંડ નં. ૧૬૩ આપી તેની સામે અંતિમખંડ નં. ૧૬૩/૧ અને ૧૬૩/૨ ફાળવેલ છે જેની દરખાસ્તો મુજબ મૂળખંડ નં. ૧૬૩ નું ક્ષેત્રફળ ૪૦,૮૪૩ ચો.મી. અને અંતિમખંડ નં. ૧૬૩/૧ નું ક્ષેત્રફળ ૧૦,૩૦૨ ચો.મી. ફાળવેલ છે અને અંતિમખંડ નં. ૧૬૩/૨ નું ક્ષેત્રફળ ૧૦,૧૧૯ ચો.મી. ફાળવેલ છે. આ પત્ર સાથે સામેલ નકશામાં દર્શાવ્યા મુજબ નીચે જણાવેલ શરતોને આધીન તેમજ નગર રચના અધિકારીશ્રી નાં અભિપ્રાયને ધ્યાને લઈ સબપ્લોટીંગ માટે પરવાનગી આપવામાં આવે છે.

ખાસ શરતો:-

૧. ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, ૨૦૦૯ (અધિનિયમ-૨૦૦૯) ની કલમ ૧૫, ૧૬ તથા ૧૭ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ (અધિનિયમ-૧૯૭૬) ની કલમ ૨૬ થી ૪૯ પ્રમાણે નગર રચના યોજના વિસ્તારમાં જમીન આવેલી હશે તો અધિનિયમ-૧૯૭૬ ની કલમ ૨૬ થી ૪૯ માં જણાવ્યા પ્રમાણેનું કોઈપણ વિકાસ કામ કરતા પહેલા ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રાદેશીક વિકાસ સત્તામંડળની જરૂરી મંજૂરી મેળવી લેવાની રહેશે. લેંડ રેવન્યુ કોડની કલમ-૬૫ પ્રમાણે જમીનનો બિનખેતી ઉપયોગ શરૂ કરતા પહેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી/કલેક્ટરશ્રીની જરૂરી પરવાનગી મેળવી લેવાની રહેશે. જેની શરતોનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે.
૨. (અ) અધિનિયમ-૨૦૦૯ અને અધિનિયમ-૧૯૭૬ મુજબ મુસદ્દારૂપ વિકાસ યોજના તથા નગર રચના યોજનાનાં રેગ્યુલેશની રૂએ જે કોઈ અંકુશ અને શરતો મુકવામાં આવ્યા હોય તેનાથી જો કોઈ નુકશાન થાય તેમ હોય તો આ નુકશાન કોઈપણ બદલા માગ્યા સિવાય માલિકને તે મુજબ શરતોનો અમલ કરવાનો રહેશે. (બ) અધિનિયમ-૨૦૦૯ અને અધિનિયમ-૧૯૭૬ મુજબ આપેલ એકત્રીકરણ અને વિકાસ પરવાનગીમાં જે શરતો મૂકી હશે તે શરતો પણ પાળવાની રહેશે.
૩. જીલ્લા કલેક્ટરશ્રી ના NA ફુકમમાં દર્શાવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.



4. વિકાસ પરવાનગીની મંજૂરીની અંદર બનાવેલી શરતો માંથી કોઇપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રાદેશીક વિકાસ સત્તામંડળ તે શરતોનો અમલ કરાવી શકશે અને ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રાદેશીક વિકાસ સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે નુકશાન, ખોટ કે હરકત માલિકને થાય તે બદલ કોઇપણ બદલા મળી શકશે નહીં.
5. પ્રજ્ઞવાળી જમીનનું કુલ ૧૦,૧૧૭ચો.મી.જમીન બિનખેતી થયેલ છે.જ્યારે નગર રચના અધિકારીશ્રી દ્વારા તૈયાર કરાયેલ કામચલાઉ પુનરચના યોજના નં.૨બી-૧ની દરખાસ્ત મુજબ અંતિમખંડ નં.-૧૬૩/૧નું કુલ ક્ષેત્રફળ - ૧૦,૩૦૨.૦૦ ચો.મી.છે .જેથી બાકી રહેતી ૧૮૫.૦૦ ચો.મી. જમીનનો બિનખેતી હુકમ સક્ષમ અધિકારી પાસેથી મેળવી બી.યુ. પરમીશન પહેલા અત્રે રજુ કરવાનો રહેશે.
6. ઉપર જણાવેલ શરતોનો ભંગ કરવા બદલ અધિનિયમ-૨૦૦૯ ની કલમ ૧૫, ૧૬ તથા ૧૭ અને અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૩૫ અને ૯૮ પ્રમાણે ફરીયાદ કરવામાં આવશે અને તે શરત ભંગ તેમાં જણાવ્યા પ્રમાણે દંડને પાત્ર રહેશે.
7. રેવેન્યુ રેકર્ડ આધારે જમીનની હદ, દબાણ તથા અન્ય સંબંધિત ચકાસણી અરજદારે ડીઆઇએલઆર કચેરી પાસેથી કરાવી લેવાની રહેશે. સંબંધિત ચકાસણી અન્વયે જે શરતો મૂકી હશે તે શરતો પણ માલિકે પાળવાની રહેશે.
8. ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, ફાયર સેફ્ટી ડિવિઝન, યુજીવીસીએલ, ગુજરાત વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડ, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી., માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત અન્ય વિભાગ/ બોર્ડ દ્વારા અપાયેલ તેમજ લેવાના થતા 'ના વાંધા પ્રમાણપત્ર' મેળવી તેમાં દર્શાવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
9. રજુ કરેલ દરેક એકિડેવિટની વિગતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
10. આ વિકાસ પરવાનગીથી જી.ડી.સી.આર. ના વિનિયમ ૩.૨.૧ મુજબ, તેમજ લાગુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ મળતી નથી, જરૂરી જે તે પરવાનગીઓ મેળવી લેવાની રહેશે.
11. વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર થયેલ નકશાઓનો એક સેટ સ્થળ ઉપર પ્રસિધ્ધ કરવાનો રહેશે.
12. વિકાસ પરવાનગી, સર્વે નંબર/બ્લોક નંબર અથવા સબપ્લોટમાં અરજદાર જે જમીનમાં કબ્જેદાર/ માલિક છે તે જમીન પુરતી પરવાનગી આપવામાં આવે છે.
13. આ પરવાનગીના કારણે અરજદારની માલિકી તથા જમીનની હદ વિસ્તાર તથા ક્ષેત્રફળ અંગેની મંજૂરી મળતી નથી, પરંતુ નિયમોનુસાર વિકાસ અંગેની મંજૂરી મળે છે તેમજ આ પરવાનગી અધિકૃત માપણી સીટ તેમજ કલેક્ટરશ્રીના જમીનની ફાળવણીના હુકમને આધિન આપેલ ગણાશે.
14. વિકાસ નકશામાં અને નગર રચના યોજનામાં જુદા જુદા વિસ્તારમાં જમીનનો અને મકાનના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરુદ્ધનો ઉપયોગ કરી શકશે નહીં. તેમજ મંજૂર કરવામાં આવેલ વિકાસ પરવાનગી મુજબના નકશાના દરેક ખંડનો જે ઉપયોગ હશે તેથી જુદો ઉપયોગ અગાઉથી મંજૂરી લીધા સિવાય કરી શકશે નહીં.
15. વિકાસ પરવાનગી સત્તામંડળના પ્રવર્તમાન નિયમો મુજબ આપવામાં આવી છે, અને ખાનગી હક્કોના નુકશાનો અંગે સત્તામંડળની કોઇપણ જવાબદારી રહેતી નથી.
16. વિકાસ પરવાનગી સત્તામંડળના અધિકારી જોવા માંગે તો તે બતાવવા માલિક બંધાયેલો છે, જો તે નહીં બતાવે તો તે કામ બંધ કરવા હુકમ કરશે અને તે મુજબ કામ બંધ કરવાનું રહેશે, તેમજ વિકાસ પરવાનગી સાથે મંજૂર કરાયેલા નકશાઓનો (લેમીનેટેડ કરાવેલ) ૧ સેટ/નકલ સ્થળ પર રાખવાનો રહેશે, તેમજ વિકાસ પરવાનગી નંબર/તારીખ તેમજ જમીનની વિગતો દર્શાવતું બોર્ડ પણ સ્થળે પ્રસિધ્ધ કરવાનું રહેશે.



17. આ વિકાસ પરવાનગી આપ્યા તારીખથી ૧૨ માસ સુધી અમલમાં રહેશે તથા આ હુકમની તારીખથી નિયમોનુસાર મળવાપાત્ર સમયમર્યાદામાં આપેલી મંજૂરી મુજબનું વિકાસ કાર્ય સમાપ્તિ રીન્યુઅલ મેળવી પૂર્ણ કરવાનું રહેશે.
18. સવાલવાળી જમીન લેન્ડ એકવીઝેશન એક્ટ-૧૯૮૪ મુજબ એકવાયર કરનારને સદરહુ એક્ટની કલમ-૪ અન્વયે નોટીફિકેશન નીકળ્યું હશે તો એકવીઝેશન એક્ટની ૨૪(૭) મુજબ જીલ્લા કલેક્ટરશ્રીની રજા બાંધકામ શરૂ કરતા પહેલા લેવાની રહેશે.
19. વખતોવખત ખાસ મૂડીરોકાણ પ્રાદેશિક વિકાસ સત્તામંડળ તરફથી તથા સરકારશ્રી તરફથી વિકાસ માટેના જે નિયમો કે સુચનાઓ તથા જાહેરાત કરાય તે બંધનકર્તા રહેશે.
20. અરજદાર આ સત્તામંડળ તથા સરકારશ્રી વખતોવખત નક્કી કરે તે મુજબના ડેવલોપમેન્ટ ચાર્જીસ, અન્ય ચાર્જીસ, ડીપોઝીટ તેમજ ફી ભરવા જવાબદાર રહેશે.
21. ઉપર જણાવેલ શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૭ ની કલમ ૨૯/૫,૩૫,૩૬,૩૭,૩૮,૪૯/૧ અને ૯૮ વગેરેની જોગવાઈ મુજબ દંડ તથા શિક્ષાને પાત્ર રહેશે.
22. જો પ્રશ્નવાળી જમીન પર બોજો હશે તો ધિરાણ કરનાર સંસ્થાના કારણો તેમને બંધનકર્તા રહેશે.
23. અધિનિયમ-૧૯૭૭ સિવાયના બીજા પ્રવર્તમાન કાયદાઓ હેઠળ લેવા પાત્ર મંજૂરીઓને આધિન રહીને વિકાસ પરવાનગી આપવામાં આવે છે.
24. વરસાદી કુદરતી પાણીના વહેણને અવરોધ ન થાય અને તેનો યોગ્ય રીતે અને સરળતાથી નિકાલ થાય તેવી જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. સવાલવાળી જમીન માંથી પસાર થતા વરસાદી કુદરતી પાણીના વહેણ યથાવત જાળવવાનું રહેશે, જે અન્વયે જળ સંપત્તિ વિભાગનો અભિપ્રાય આપરી ગણી, તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જરૂર જણાય ત્યાં નાળું/કલવઈની વ્યવસ્થા કરવાની રહેશે.
25. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ જમીનમાં વોટર રિચાર્જીંગ કુવા અંગેનું આયોજન જીડીસીઆરમાં દર્શાવ્યા મુજબ કરવાનું રહેશે.
26. મંજૂર કરેલ આ યોજનામાં નિયમ મુજબ સ્થળે રોડ સાઇટ ફ્રન્ટ માર્જીનમાં કચરાપેટી તથા ટપાલબોક્ષને લગતી સુવિધા આયોજકે કરવાની રહેશે.
27. રજૂ કરેલ લે-આઉટમાં દર્શાવેલ કોમન પ્લોટની માલિક બિનતબદીલ તથા અવિભાજ્ય સત્તા પ્રકારની રહેશે. તેમજ સદરહુ લે-આઉટના મંજૂર કરેલ તમામ પ્લોટ/ટેનામેન્ટના વખતો-વખતના માલિકોનો પણ વણવહેચાયેલ સમાન હિસ્સો રહેશે.
28. અત્રેથી વિકાસ પરવાનગી મેળવ્યા બાદ રેરા એક્ટ-૨૦૧૬ મુજબ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરીટીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
29. લે-આઉટમાં દર્શાવેલ ઓપન સ્પેશ, બાંધકામ નિયંત્રણ રેખા તથા કોમન પ્લોટની ખુલ્લી જમીનમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ/વિકાસ કાર્ય કરવાનું રહેશે નહીં.
30. મંજૂર કરેલ આયોજનમાં નિયમોનુસાર સોસાયટી ખુલ્લી જમીનમાં ઇલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર માટેની જમીન અલગથી ફાળવવા અંગેની જે તે સુવિધા આયોજકે કરવાની રહેશે.
31. એન્જી.શ્રી/સ્ટ.એન્જી.શ્રી/ ડેવલોપરશ્રીએ નેશનલ બિલ્ડીંગ કોડની જોગવાઈઓનું તેમજ જીડીસીઆરની જોગવાઈઓનું તથા રજૂ કરેલ એફીડેવીટનું ચુસ્તપણે અમલ કરી બાંધકામ કરવાનું રહેશે.
32. સદર જમીનમાં બાંધકામ/ વિકાસ શરૂ કરતા પહેલા સાઇટ સુપરવાઇઝરનું અત્રેનું જરૂરી રજીસ્ટ્રેશન મેળવી સ્થળે બાંધકામ/વિકાસ કરવાનો રહેશે.



33. આ પરવાનગી ફક્ત રહેણાંક હેતુ માટે સબપ્લોટીંગ કરવા માટે આપવામાં આવી છે. જેમાં બાંધકામનું કામ શરૂ કરતા પહેલા અત્રેથી મંજૂરી મેળવી લેવાની રહેશે.
34. ઉપરોક્ત કોઇપણ શરતોનો ભંગ થતા આ પરવાનગી આપોઆપ રદબાતલ થયેલી ગણાશે અને ગેરકાયદેસરનું ગણી તે પરત્વે કાયદાનુસાર પગલા લેવા પાત્ર થશે.

ઉપરોક્ત શરતોને આધીન મોજે- ધોલેરા, તા.ધોલેરા, જીલ્લો અમદાવાદના જુના સર્વે નં.૪/૨ પૈકી ૩ (નવો સર્વે નંબર-૪૯) ને ન.ર.ચો.નં રબી-૧ની કામચલાઉ પુનઃબંધારણની દરખાસ્ત મુજબ, ફાળવેલ અંતિમ ખંડ નં. ૧૬૩/૨ માં તેમની માલીકીની બિનખેતી થયેલ જમીન પુરતી જમીનમાં અને મૂળખંડની જ જમીનમાં આવતી અંતિમખંડ ની જમીનમાં સંપૂર્ણ કે અંશતઃ ભળતા અને રે.સર્વેનં.૫૧ નાં મૂળખંડ નં.૧૬૫ની જમીનમાં સંપૂર્ણ કે અંશતઃ ભળતા રહેણાંક હેતુના ખુલ્લા સબ પ્લોટીંગ માટે કુલ સબ પ્લોટ નં. ૧ થી ૨૫, કોમન પ્લોટ-૧ (ક્ષેત્રફળ-૫૨૬.૫૦ ચો.મી.), કોમન પ્લોટ-૨(ક્ષેત્રફળ-૪૯૦.૧૪ ચો.મી.) અને ૧૨ મીટર પહોળા રસ્તા પુરતી જે તે શરતોને આધીન પુરતી વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

મુખ્ય કારોબારી અધિકારીશ્રી દ્વારા મંજૂર કર્યા મુજબ.

ક્રમાંક: પીઆરએમ/૬૮૦/૬૨૩

તારીખ: ૨૬/૧૦/૨૦૨૦

Sandhu

સીનીયર ટાઉન પ્લાનર

ડીએસઆઇઆરડીએ, ગાંધીનગર

To,

Gujarat RERA Authority


Gandhinagar.

Respected Sir,

Subject – FIDATO LUXURIA – 3 project FP No. Clarification

Pertaining to query raised by RERA authority, hereby we are giving clarification with regards to our project FIDATO LUXURIA-3, with reference to RAJACHITHI submitted to you for RERA registration, that at the time of Land Sale-Deed said property was under FP No. 829/2 of Survey No. 49 and later DHOLERA SIR DEVELOPMENT AUTHORITY changed same to NEW FP No. 163/2 in Survey No. 49 which is mentioned in RAJACHITTHI also.

Please consider our clarification and complete the RERA registration process.

Thanking you,
FOR FIDATO BUILDCON

PARTNER

Dt. 28-05-2021

To,

Gujarat RERA Authority

Gandhinagar.

Respected Sir,

Subject – FIDATO LUXURIA – 3 project FP No. Clarification


Pertaining to query raised by RERA authority, hereby we are giving clarification with regards to our project FIDATO LUXURIA-3, old survey no. 4/2 PAIKKI 3 was with old F.P. no. 829/2 but due to human typing error in new F.P. no. new Survey no. 49/2 was wrongly typed in Land Sale-Deed. So as per RAJACHITTHI it needs to be considered as below

NEW SURVEY NO. 49

NEW F.P. NO. 163/2

Please consider our clarification and complete the RERA registration process.

Thanking you,

FOR FIDATO

PARTNER

To,

Gujarat RERA Authority

Gandhinagar.

Respected Sir,


Subject – FIDATO LUXURIA – 3 project Land Size in FP Clarification

Pertaining to query raised by RERA authority for land size, hereby we are giving clarification with regards to our project FIDATO LUXURIA-3, as per N.A. 10117 Sq. Mtr. land was permitted and at the time of Plan-Pass after re-survey it was mentioned 10119 Sq. Mtr. in approved plan pass.

Please consider our clarification and complete the RERA registration process.

Thanking you,

FOR FIDATO BUILDCON



PARTNER